



ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સંહતિ", છઠ્ઠો માળ, એસ.આઈ.ઈ.સી.સી. કેમ્પસ, ખજોદ ચાર રસ્તા પાસે, અલથાણા રોડ, સરસાણા, સુરત - ૩૯૫ ૦૦૭

ફોન નં. ૨૨૮૧૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

Ref no. PN 2025-26/306

Dt. 23/01/2026

તંત્રીશ્રી, _____, સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના ટૅન્કમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,

(સેક્રેટરી)

ચેમ્બરે કેન્દ્ર સરકારને પ્રિ-બજેટ મેમોરેન્ડમ માટે મહત્વના ૧૫ સૂચનો મોકલ્યા

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર - ઉદ્યોગને સ્પર્શતા અતિ મહત્વના ૧૫ સૂચનો કેન્દ્ર સરકારને પ્રિ-બજેટ મેમોરેન્ડમ માટે મોકલવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.

1. CBDT દ્વારા સ્પષ્ટીકરણાત્મક SOP જાહેર કરવામાં આવે.

હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને CBDT દ્વારા વિવાદ ઘટાડવા માટે RBIની જેમ સ્પષ્ટતા કરનાર SOP જાહેર કરવી જોઈએ. આવકવેરા અધિનિયમના અમલ દરમિયાન છેલ્લા કેટલાંક વર્ષોમાં વિવિધ હાઇકોર્ટો દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા છે. આવા ચુકાદાઓના કારણે ફિલ્ડ લેવલ પર કાર્યરત Assessing Officers માટે કાયદાનો સમાન અને યોગ્ય અમલ કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે, સમાન પરિસ્થિતિમાં અલગ-અલગ કરદાતાઓ સાથે જુદો જુદો વ્યવહાર થતો હોય છે, જેનાથી કરદાતાઓમાં અસંતોષ અને વ્યાપક વિવાદો ઊભા થાય છે, તેને કારણે આ માંગણી કરવામાં આવી છે.

RBI દ્વારા બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં નિયમન કરતી વખતે સમયાંતરે સ્પષ્ટતા કરનાર SOP જાહેર કરવામાં આવે છે, જેથી ફિલ્ડ લેવલ પર એકસરખો અમલ થાય અને નિયમનાત્મક અનિશ્ચિતતા દૂર

થાય. એ જ રીતે, CBDT દ્વારા પણ હાઇકોર્ટના મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતા ચુકાદાઓનું વિશ્લેષણ કરીને, જ્યાં સુધી સુપ્રિમ કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્પષ્ટીકરણાત્મક SOP જાહેર કરવાની પ્રથા વિકસાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આવી SOP દ્વારા કયા મુદ્દાઓ પર અપીલ કરવી, કયા મુદ્દાઓ પર વિવાદ આગળ ન વધારવો તથા કઈ સ્થિતિમાં કરદાતાને રાહત આપવી તે બાબતો સ્પષ્ટ થઈ શકે. આથી અનાવશ્યક અપીલો, પુનરાવર્તિત લિટિગેશન અને સરકાર તથા કરદાતા બંને માટેનો સમય અને ખર્ચ બચી શકે છે. ઉપરાંત, “Ease of Doing Business” તથા “Non-Adversarial Tax Regime” જેવા સરકારના ઉદ્દેશ્યોને પણ વાસ્તવિક રીતે સિદ્ધ કરવામાં મદદ મળશે.

2. બ્લોક એસેસમેન્ટની વ્યવસ્થા

દર વર્ષે અલગ-અલગ સ્ક્રુટિનીના બદલે આંતરરાષ્ટ્રીય પ્રથાને અનુસરીને 2-3 વર્ષના બ્લોક માટે એસેસમેન્ટ કરવાની પદ્ધતિ અમલમાં લાવવામાં આવે. હાલમાં આવકવેરા વ્યવસ્થામાં દર વર્ષે અલગ-અલગ સ્ક્રુટિની એસેસમેન્ટ થવાથી એક જ પ્રકારના મુદ્દાઓ વારંવાર ઉઠે છે, જેના કારણે કરદાતાઓ અને કરવેરા પ્રશાસન બંને પર અનાવશ્યક પ્રશાસકીય ભાર પડે છે. સતત સ્ક્રુટિનીના કારણે વ્યવસાયિક નિશ્ચિતતા ઘટે છે અને લાંબા સમય સુધી કરદાતાઓ પર અનુપાલનનું દબાણ રહે છે. આ મુદ્દા પર તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા પ્રણય રોય અને રાધિકા રોય (NDTV) સંદર્ભે આપવામાં આવેલો ચૂકાદો નોંધપાત્ર છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વિકસિત દેશોમાં 2 થી 3 વર્ષના બ્લોક માટે એસેસમેન્ટ કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે, જેમાં કરદાતાની આવક, ખર્ચ અને પાલનની એકસાથે સમીક્ષા કરવામાં આવે છે. આવી પદ્ધતિથી સમાન મુદ્દાઓ પર પુનરાવર્તિત તપાસ ટળે છે, કરવેરા અધિકારીઓનો સમય બચે છે અને સમગ્ર પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બને છે.

બ્લોક એસેસમેન્ટ અમલમાં મૂકવાથી કરદાતાને લાંબા ગાળાની સ્પષ્ટતા અને સ્થિરતા મળશે તથા “Ease of Doing Business”ના ઉદ્દેશ્યોને વેગ મળશે. સાથે સાથે, કરવેરા પ્રશાસન માટે પણ ગુણવત્તાસભર એસેસમેન્ટ અને વિવાદોમાં ઘટાડો શક્ય બનશે.

3. ટ્રાન્સફર પ્રાઇસિંગ માટે અલગ એસેસમેન્ટ

ટ્રાન્સફર પ્રાઇસિંગ અને નોન-ટ્રાન્સફર પ્રાઇસિંગ માટે અલગ-અલગ એસેસમેન્ટ પ્રક્રિયા અપનાવવામાં આવે. ટ્રાન્સફર પ્રાઇસિંગના મુદ્દાઓ અત્યંત ટેક્નિકલી, આંતરરાષ્ટ્રીય ધોરણો આધારિત અને વિશેષ જાણકારી માંગતા હોય છે, જ્યારે નોન-ટ્રાન્સફર પ્રાઇસિંગ એસેસમેન્ટ સામાન્ય આવકવેરા મુદ્દાઓ સુધી મર્યાદિત હોય છે. બંનેને એક જ એસેસમેન્ટ પ્રક્રિયામાં લેવાના કારણે સમય વેડફાય છે અને અનાવશ્યક વિવાદો ઊભા થાય છે. ટ્રાન્સફર પ્રાઇસિંગ માટે અલગ એસેસમેન્ટ અને વિશેષ અધિકારીઓની વ્યવસ્થા

કરવાથી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને ગુણવત્તાસભર બનશે, આથી કરદાતાને સમયસર નિષ્કર્ષ મળશે અને લાંબા ગાળાની લિટિગેશનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

4.કલમ 158ABનો અસરકારક અમલ

સુપ્રિમ કોર્ટમાં સમાન મુદ્દા પેઢિંગ હોય તેવા કેસોમાં અપીલ ન કરવામાં આવે અને પ્રોટેક્ટિવ એસેસમેન્ટની પ્રથા અપનાવવામાં આવે. આવકવેરા અધિનિયમની કલમ 158ABનો હેતુ એ છે કે જ્યારે સમાન કાનૂની મુદ્દો સુપ્રિમ કોર્ટમાં પેઢિંગ હોય ત્યારે પુનરાવર્તિત અપીલો ટાળવામાં આવે. વ્યવહારિક રીતે આ જોગવાઈનો ફિલ્ડ લેવલ પર પૂરતો અમલ થતો નથી, જેના કારણે અનાવશ્યક લિટિગેશન વધે છે. આવા કેસોમાં પ્રોટેક્ટિવ એસેસમેન્ટ અપનાવવાથી સરકારના હિતોની સુરક્ષા પણ રહેશે અને કરદાતાને લાંબા સમય સુધી અપીલ પ્રક્રિયામાં ખેંચાવું નહીં પડે. આથી ન્યાયિક સમય, પ્રશાસકીય સંસાધનો અને ખર્ચમાં નોંધપાત્ર બચત શક્ય બનશે.

5.રિવાઇઝ્ડ રિટર્ન દ્વારા કરાયેલા ક્લેઈમની માન્યતા

અધિનિયમમાં સુધારો કરીને રિવાઇઝ્ડ રિટર્ન દ્વારા કરાયેલા ક્લેઈમને અયોગ્ય ન ગણવામાં આવે.

6.સ્પષ્ટીકરણાત્મક જોગવાઈ પુનઃ અમલ-સંક્ષિપ્ત વિશ્લેષણ

હાલમાં એવું જોવા મળે છે કે, જે મુદ્દાઓ અપીલ, રેફરન્સ અથવા રિવિઝન હેઠળ વિચારાધીન હોય છે, તે જ મુદ્દાઓ પર ફરીથી રીએસેસમેન્ટ શરૂ કરવામાં આવે છે, જેના કારણે ડબલ કાર્યવાહી અને અનાવશ્યક વિવાદો ઊભા થાય છે. આવી પ્રથા કરવેરા વ્યવસ્થાની ન્યાયસંગતતા અને નિશ્ચિતતાને નુકસાન પહોંચાડે છે. સ્પષ્ટીકરણાત્મક જોગવાઈ પુનઃ અમલમાં લાવવામાં આવે તો ફિલ્ડ લેવલ પર એકસરખો અમલ શક્ય બનશે અને અતિશય લિટિગેશન ટળશે. ઉપરાંત, એસેસમેન્ટ ફરી ખોલવા માટે જારી કરવામાં આવતી શો-કોઝ નોટિસનો જવાબ આપવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવાથી કરદાતાને યોગ્ય તૈયારી અને અસરકારક પ્રતિસાદ આપવા ન્યાયસંગત તક મળશે. આ સુધારાથી “Non-Adversarial Tax Regime”નો ઉદ્દેશ્ય સાકાર થશે અને કરદાતા તથા પ્રશાસન વચ્ચે વિશ્વાસ વધશે.

7.રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી

સુધારેલ તથા બેલેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી ઉપલબ્ધ રાખવામાં આવે.

8.રિફંડ માટે સમયમર્યાદા અને વધારાનો વ્યાજ દર

રિફંડ 30 દિવસમાં આપવામાં આવે અને વિલંબ થાય તો 9% વાર્ષિક વ્યાજ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવે.

9. Prior Period Expensesની કપાત

વ્યવસાયિક વ્યવહારોમાં ઘણીવાર કેટલાક ખર્ચો અગાઉના વર્ષ સાથે સંબંધિત હોવા છતાં તેનો નિર્ધારણ અથવા બીલ મોડું પ્રાપ્ત થવાને કારણે વર્તમાન વર્ષમાં થાય છે. હાલની કાનૂની સ્થિતિ મુજબ આવા ખર્ચોને ટેક્નિકલ કારણોસર નામંજૂર કરવામાં આવે છે, જેના કારણે વાસ્તવિક નફા કરતા વધુ કર ભરવાનો ભાર કરદાતાને સહન કરવો પડે છે. કલમ 37(1) હેઠળ અગાઉના સમયગાળાના વાસ્તવિક અને વ્યવસાય સંબંધિત ખર્ચને વર્તમાન વર્ષમાં કપાત તરીકે મંજૂરી આપવાથી યોગ્ય આવક ગણતરી શક્ય બનશે. આથી અનાવશ્યક વિવાદો ઘટશે અને એકાઉન્ટિંગ તથા કરવેરા વચ્ચે સુસંગતતા વધશે. ઉપરાંત, કરદાતાઓને અપીલ પ્રક્રિયામાં જવું નહીં પડે અને સ્વૈચ્છિક પાલન પ્રોત્સાહિત થશે.

10. સ્પષ્ટ વ્યવસાયના નુકસાનનું સેટ-ઓફ

કલમ 5AD હેઠળના વ્યવસાય નુકસાનને અન્ય વ્યવસાયના નફા સામે સેટ-ઓફ કરવાની મંજૂરી આપવામાં આવે.

11. MSME અને માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે રાહત

માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે પ્રિઝમ્પટિવ ટેક્સેશન યોજનાની ટર્નઓવર મર્યાદા રૂ. 2 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવે.

12. TDS દરોની સરળતા

વિવિધ TDS દરોના કારણે થતા વિવાદો ઘટાડવા TDS સ્લેબને માત્ર 3 સુધી મર્યાદિત કરવામાં આવે.

13. GST/B2B વ્યવહારો માટે કલમ 194Q રદ કરવી

GST હેઠળ આવતી તથા B2B વ્યવહારો માટે કલમ 194Q હેઠળનું TDS સંપૂર્ણપણે રદ કરવામાં આવે.

14. સ્ટાર્ટઅપ્સ માટે નુકસાનની કેરી ફોરવર્ડની છૂટ

DPITમાં નોંધાયેલ સ્ટાર્ટઅપ્સ તથા LLP સ્વરૂપે સ્થાપિત સ્ટાર્ટઅપ્સને કલમ 79 મુજબ નુકસાનની કેરી ફોરવર્ડ અને સેટ-ઓફની છૂટ આપવામાં આવે.

15. Updated Return માટે શરતોમાં ઢીલ

કલમ 139(8A) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની કડક શરતોમાં રાહત આપવામાં આવે.

ટેક્સટાઇલના મુદ્દાઓ

1. ટેક્સટાઇલના બેઝિક રો મટીરીયલ PTA અને MEG ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરવાની રજૂઆત કરવામાં આવી છે.

2. MMF ચાર્જ (પોલિએસ્ટર) પર ઈમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરવા રજૂઆત કરાઈ છે.
3. સિલ્ક ચાર્જ HSN કોડ 5002 ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની રજૂઆત કરાઈ છે.
4. TTDS સ્કીમ અથવા નવી એ-ટફ સ્કીમ માટે રૂ. 1000 કરોડની માંગ કરવામાં આવી છે.
૫. સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે હાલમાં કોઈ સ્કીમ નથી, તેવા સંજોગોમાં સેન્ટર ઓફ એક્સલન્સ માટે ઓછામાં ઓછી રૂ. ૧૦૦ કરોડની માંગ કરવામાં આવી છે.
6. જૂની ટેક્સટાઇલ સ્કીમો જેવી કે ચાર્જ બેન્ક સ્કીમ, ગ્રુપ વર્કશોડ સ્કીમ માટે રૂ. 50 કરોડની માંગ કરવામાં આવી છે.
7. સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ ઇન ટેક્સટાઇલ માટે રૂ. 500 કરોડની માંગ કરવામાં આવી છે.
૮. MSME માટે MSECDP સ્કીમમાં CFA (સેન્ટ્રલ ફાઇનાન્સિયલ આસિસ્ટન્ટ)ની મર્યાદા રૂ. 50 કરોડ સુધી કરવાની માંગ કરવામાં આવી છે.
૯. ટ્રેડર્સને માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝની વ્યાખ્યામાં એવી રીતે ઉમેરવામાં આવે કે જેથી ઇન્કમ ટેક્સની સેક્શન 43 (B)(H)નો લાભ તેઓને મળી શકે.
10. MSME દ્વારા ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુડ પ્રોડક્ટ બનાવવા માટે PLI સ્કીમ આપવામાં આવે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ થ્રેસ હોલ્ડ લિમિટ પણ રિવાઈઝ MSMEની વ્યાખ્યા મુજબ કરવામાં આવે.
૧૧. MSME માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે સ્પેશ્યલ ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવામાં આવે.
૧૨. સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવે અને એ પ્રમાણે બેંક ક્રેડિટનો લાભ આપવામાં આવે.
૧૩. લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવા માટે દેશમાં વિવિધ જગ્યાએ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર કાર્ગો ડેવલપ થાય એના માટે સ્પેશિયલ ફંડની ફાળવણી કરવામાં આવે.